

ॐ

॥ तर्यां वाचकः प्रणवः ॥

લતમભરા

આત્મનો હિતાય જગતઃ સુખાય



પ.પુ. ગુરુદેવશ્રી યોગાલિક્ષુણ

વર્ષ - ૩૯ (જુલાઈ, ઓગસ્ટ, સપ્ટે.)

VOL - 39, 2023-24

ISSUE-I

માનદ તંત્રી : મિનિષ પટેલ

Published on Every 3 Months

‘યોગ’ બિક્ષા લાવીએ, ‘બિક્ષુ’ બની ગુરુદ્વાર;
મુમુક્ષુ જરૂર પામશે, સૌનો મુજમાં ભાગ.

॥ॐ॥
॥तस्य वाचकः प्रणवः ॥



रुतभरा (ऋतभरा) एटले अनुभवयुक्त सत्यथी भरेलुं बहुजनहिताय-बहुजनसुखाय

भावांजलि

(श्री डॉ. सद्गुरु समर्पणाभिक्षुज्ञने)

-शशीकान्त पटेल

सत्य-धर्म गुरुदेवनी ज्य. सत्य अने धर्म एज
आपणा गुरुदेव अने अमनी ज्य तो ज आपणी ज्य.

ओम् परिवारना आध्यात्मिक वडा,
स्वयम् सिध्ध, योगीराज, महामुक्त, परमपुरुष,
शिष्योना परमात्मा प.पू.सद्गुरुदेव श्री योगभिक्षुज्ञ
महाराजना आध्यात्मिक मानस पुत्र एटले श्री सद्गुरु
समर्पण भीक्षुज्ञ (डॉ. सोमाभाई पटेल). तेओश्री
विक्रम संवत् २०७८ वैशाख वद ४८ ता. ११-५-
२०२३ ने गुरुवारना रोज कोई पण आगोतरा अंधाणा
वीना ऐकाएक ओमपुरी सिधाव्या. तेमनुं आत्म
चैतन्य परम् चैतन्यमां वीलीन थई गयुं. ओर्हीता ज
बनेल आ आधातज्ञनक बनावथी तेओश्रीना
पारीवारीक, सामाजिक, आध्यात्मिक सर्वे
आत्मियज्ञनोने असर्व आधातनो आंयको लागे ते
स्वाभाविक छे.

आपणे जाणीये छी एके समाजमां फेलायेला
अभ्यो, अभ्यासो, कुरीवाजे, अंधश्रव्या, स्वार्थ, ईर्षा,
असहीष्णुता, भिथ्याअभीमान, मृगज्ञ समान
भौतिक भोगो ग्राम करी, भोगवी ते द्वारा अंते हुः खने
ज आपनार आभासी सुख-शांति प्राप्त करवानी
आंधणी घेलछा वीर्गे जेवा उधर्द रुपी दुष्प्रणो समाजने
झोखलो करी नांभे छे. परिणामे समाजनो बहोणो

वर्ग साचा-शाश्वत सुख-शांति प्राप्त करवामांथी वंचीत
रही ज्य छे अने ज्वनभर ताप-परीतापथी पीडातो
-हुः भी थतो रहे छे. प.पू. सद्गुरुदेव ओम्
परमात्मानी प्रेरणाथी ज सौ कोई आवा दुष्प्रणोमांथी
समज्ञ धूर्वक मुक्त थई परस्पर प्रेम, सहिष्णुतानी
उमदा भावना सहीत संयम-नियम-सत्य-धर्मभय,
सात्विक-सदाचारी अने वधु ने वधु सत्कर्मो युक्त ज्वन
ज्वी साचा-शाश्वत सुख-शांति पामे, ते माटे ज्ञानरूपी
साची समज्ञानो अनेक माध्यमो द्वारा प्रयार-प्रसार
करी सर्व ज्व छिताय-सुखाय नुं महाभगीरथ कार्य
ज्वनभर करता रह्या. तेमां श्री सद्गुरु समर्पण भीक्षुज्ञ
पण तेनो लाभ वधु ने वधु जनसमुदायने मणे ते माटे
पूज्यश्रीना भार्गदर्शन अने अनुशासनमां रही तन-
मन-धन-विचार-वाणी-वर्तनथी अथाकपाणे प्रेम अने
दृढता धूर्वक कार्यरत रह्या. तेओश्री भूष-थाक-तरस-उंध-
शीयाणो-उनाणो-योमासु जेवा अनेक प्राकृतिक परीबળो
प्रत्ये अडग रही सत् पुरुषार्थ वाणथंभ्या सतत करता
रह्या. आ बधु तेओ पोते पोताना स्वतंत्र नीशयथी कार्ही
ज करता नही. तेमके तेओश्री अनुशासनमां रहीने ज
बहुजन हिताय-सुखाय नुं दरेक कार्य करवाना आग्रही
हता. तेओश्रीना आ उमदा सद्गुरुशमांथी आपणने
अनुशासनमां रहेवानी सतत प्रेरणा मणती रही छे.

॥ सत्यधर्म गुरुदेव की ज्य ॥

रुतभरा

जुलाई-२०२३

તેઓશ્રી ડોક્ટર હોવાથી ખુબ વ્યસ્ત રહેતા સાથે સાથે પારીવારીક જવાબદારી પણ ખરી તદ્વારાંત સદ્ગુરુદેવની કેટલીક જવાબદારી અને ઓમ્ભુ પરિવારની જવાબદારી પણ તેમની ઉપર રહેતી. વળી તે નીભાવવામાં ક્યારેક બાધારૂપ વીપરીત પરીસ્થિતિ પણ સામે આવતી, તેનાથી ક્યારે પણ વીચલીત થયા વગર તે સર્વે ઉપર કુનેહ પૂર્વક ગુરુકૃપાએ વીજય મેળવી, સદ્ગુરુદેવના ચીધ્યા રાહે અડગ રહી દફ્તાપૂર્વક સર્વ જીવ હિતાય-સુખાયના નિષ્ઠામ પુરુષાર્થમાં જીવનના છેલ્લા શાસ સુધી તૈલધારાવત કાર્યરત રહ્યા. સદ્ગુરુદેવે પરમકૃપા વરસાવતા તેમનું આધ્યાત્મિક નામકરણ “શ્રી સદ્ગુરુ સમર્પણ ભિક્ષુ” કરેલ. ભિક્ષુનો અર્થ થાય ત્યાગી-ત્યાગ કરનાર. સદ્ગુરુ સમર્પણ ભિક્ષુનો અર્થ થાય શ્રી સદ્ગુરુદેવને સર્વાંગી-સંપૂર્ણ સમર્પિત થઈ જીવવામાં જે કોઈ પરીબળ બાધારૂપ-અંતરાયરૂપ હોય તે સર્વનો વીના વીલંબે ત્યાગ કરનાર. આમ તેઓશ્રીના આધ્યાત્મિક નામમાંથી પણ સૌને મનુષ્ય જન્મ સાર્થક કરવામાં અનિવાર્ય એવી પોતાના ઈષ પ્રત્યે સમર્પિત થઈ જીવન જીવવાની સતત પ્રેરણા મળે છે. તેઓશ્રી સદ્ગુરુદેવને તો સમર્પિત હતા જ પરંતુ સાથે સાથે સમસ્ત ઓમ્ભુપરિવારને પણ સમર્પિત હતા. કેમકે તેઓશ્રી સમસ્ત ઓમ્ભુ પરિવારમાં સદ્ગુરુદેવનું પ્રતિબિંબ નીહાળતા-અનુભવતા. લોકકલ્યાણના આ ભગીરથ કાર્યમાં જે કોઈ સ્વયં સેવક આણસ કે બેદરકારીના કારણે સહેજ પણ ચૂક થાય તો તે માટે તેઓ તેનું પ્રેમથી ધ્યાન દોરતાં, ક્યારેક જરૂર પડે તો તીખી ભાષાનો પણ ઉપયોગ કરી દેતા. ક્યારેક આવુ જે કાંઈ વર્તન તેઓ કરતા તેમા માત્ર ગુરુજ્ઞા જીવનભરના નિષ્ઠામ સર્વ જીવ હિતાય-સુખાયના મુખ્ય ઉદેશ્યની પૂર્તી વધુ સારી રીતે થાય તે જ તેમનો

હેતુ રહેતો. વાસ્તવમાં તેમના મનમાં કોઈ પણ પ્રત્યે સહેજ પણ કડવાશ ક્યારે પણ પેદા થઈ નથી. પૂજ્યશ્રીને હર હાલમાં સર્વાંગી-સંપૂર્ણ સમર્પિત થઈ તથા સાથે સાથે અનુશાસનમાં રહી જીવનના છેલ્લા શાસ સુધી સર્વ જીવ હિતાય-સુખાયના લોકકલ્યાણના ભગીરથ કાર્યમાં અવીરત કાર્યરત રહી તેઓશ્રીએ વીરલ કર્મયોગીનું જીવન જીવી જન્મ સાર્થક કર્યો. પૂજ્યશ્રી ધ્વારા રચાયેલ ઓમ્ભુ પરિવાર રૂપી આધ્યાત્મિક મુમુક્ષુજ્ઞનો રૂપી ઈમારતના તેઓશ્રી પૂજ્યશ્રી પદી મુખ્ય આધારસંભ હતા. કાયમ માટે સૌ કોઈ એમના માર્ગદર્શન અને અનુસાશનમાં રહીને જ લોકકલ્યાણના કાર્યમાં પરસ્પર પ્રેમ-સંપ અને વિવેકપૂર્ણ ઉત્સાહથી સમજણ પૂર્વક કાર્ય કરતા રહેલ છે.

ઓમ્ભુ પરિવારના આધ્યાત્મિક વડા, શિષ્યોના પરમાત્મા પ. પૂ. સદ્ગુરુદેવ શ્રી યોગભિક્ષુજ્ઞ મહારાજ તા. ૨૪-૨-૨૦૨૩ ને શુક્રવારે બ્રહ્મલીન થયા. તથા ટુંક સમયમાં તા. ૧૧-૫-૨૦૨૩ ને ગુરુવારે શ્રી સદ્ગુરુ સમર્પણ ભિક્ષુજ્ઞ ઓમપુરી સિધાયા. આમ ખુબ ઓછા સમય ગાળામાં કોઈ આગોતરા અંધારા વીના બનેલ આ આ આધાતજનક બનાવથી પ. પૂ. સદ્ગુરુદેવના સર્વે આધ્યાત્મિક ભક્તો, શિષ્યો, પ્રેમીજનોના મનમાં સતત એક જ પ્રશ્ન ઘુમરાતો રહ્યો કે ઓમ પરિવારની મુખ્ય આધારશીલા એવા પ. પૂ. સદ્ગુરુદેવ અને આધાર સંભ એવા સદ્ગુરુ સમર્પણ ભિક્ષુજ્ઞ સદેહે આપણી વચ્ચે હયાત નહી હોવાથી ઓમ પરિવારનુ તથા તે ધ્વારા થતા સરવજીવ હિતાય-સુખાયના સર્વ કાર્યો અત્યાર સુધી જે ક્ષમતાથી સુઆયોજીત રીતે થતા રહ્યા છે તેનું શું થશે? આવું વિચારવું તે ભુલ ભારેલું છે. કેમ કે તેઓશ્રી હયાત હતા ત્યારે ઓમ્ભુ પરિવારના અડગ આધાર સંભ હતાં જ, પરંતુ તેઓશ્રી સદેહે આપણી વચ્ચે હયાત નથી

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને તેમની જ્ય તો જ આપણી જ્ય ॥

ત्यारे तेमने जે ઉચ्च આદર્શोનું સમस्त જીવન દરમ्यાન ચુસ્ત પાલન કરી વિશેષ અને વિરલ કર્મયોગીનું જીવન જીવતા રહ્યા. તે આદર્શોને જો આપણો સતત સ્મરણામાં રાખીશું તો તે ઉચ્ચ આદર્શો આપણા સૌ માટે પ્રેરક એવો સુક્ષ્મ આધારસ્તંભ બનીને જે રહેશે તે નીઃશંક છે.

તો આપણો સૌ તેઓશ્રીના આ ઉચ્ચ આદર્શોને હર હાલમાં પ્રેમપૂર્વક અપનાવી સર્વ જીવ હિતાય-

સુખાયના લોકકલ્યાણના મહાભગીરથ કાર્યને અવીરત, વણથંભ્યા, પરસ્પર પ્રેમ-સંપ-સહિષ્ણુતાપૂર્વક સતત આગળ ધ્યાવવા સંકલ્યબધ થઈને તેઓશ્રીને સાચી ભાવાંજલિ અર્પણ કરીયે.

અસ્તુ

સત્ય-ધર્મગુરુની જ્ય. સત્ય અને ધર્મ એ જ આપણાં ગુરુદેવ અને તેમની જ્ય તો જ આપણી જ્ય. ઓમ્.....ઓમ્.....ઓમ્.....ઓમ્.....

ગાયત્રી-અનુષ્ઠાન-સાધના-શિબિર

(સંક્ષિપ્ત દિવ્ય અહેવાલ)

ગતાંકથી કુમશા:

સંકલન : ડૉ. સ.સ.ભિક્ષુ

કુટીરોની રચનામાં વચ્ચે પૂ. ગુરુદેવની મોટી કુટીર અને આજુભાજુ બે નાની કુટીરો અને તેની સામે બાકીની કુટીરો. શ્રી ગુરુદેવની કુટીર સામે એક ચોક, જેમાં વચ્ચે લગભગ વીસેક ફૂટ ઊંચો વળો ઊભો કરેલો જેની પર ઓમ્ ભગવાનની ધજા ફરકવવામાં આવી હતી. ચોકમાં લગભગ ૧૨૦ માણસો બેસી શકે તેવી જગ્યા હતી. જ્યાં સવારે, સાંજે અથવા જ્યારે પણ પૂજયશ્રીને શિબિરાર્થીઓને મળવાની ઈચ્છા થાય ત્યારે એકઢા થતાં.

પહેલાં જણાવી ગયા તેમ કુટીરોની રચના સ્વતંત્ર પ્લોટ જેવી હતી. એકેય દીવાલ બીજી સાથે જોડાએલી નહોતી. થોડીક કુટીરોની દીવાલો અડકેલી હતી પણ દરેક માટે સ્વતંત્ર કુટીર હતી.

કુટીરોનું કામ આગળ ચાલી રહ્યું હતું. પ્રથમ ખેતરને પાણી પાવામાં આવ્યું. પછી એને ખેડવામાં આવ્યું. ખેડ્યા પછી સમારથી સપાટ બનાવવામાં આવ્યું. થોડાક દિવસ ખેતર સુકાયા પછી તેના પર માપ પ્રમાણે લીટા દોરાયા. કુટીરોની રચના માટે ધાસ (બાજરીના

પૂળા) શ્રી નાથાભાઈએ એકઢા કર્યા. તેઓના સતત પરિશ્રમથી કુટીરો ઊભી થઈ. કુટીરોમાં વપરાતાં વાંસ, વળી વગેરેની શ્રી વસંતભાઈ દવેના ત્યાંથી ત્રણ મોટી ટ્રક ભરાઈને આવેલી. ભાનુભાઈને ત્યાંથી વીજળીનો સામાન આવેલો, જેમાં વાયર અને હોલ્ડરો ખાસ હતાં.

શ્રી ભાનુભાઈએ પણ ખૂબ સારો સહકાર આપેલો. રાત્રીના બે-ત્રણ વાગે ભાનુભાઈ ગાડી લઈને પલિયડ આવતા. શ્રી દવે અને શ્રી ભાનુભાઈને પૂછ્યું કે તમારા વાંસ-વળીને કાપવા પડે તો ? બંનેનો એક સરખો જ જવાબ હતો કે અમારાં સારાં નસીબ કે અમને આવો લાભ મળ્યો, ભલે બધા કપાય તોય વાંધો નથી.

ધાસ ઓછામાં ઓછું દસેક ટ્રક વપરાયું હશે, જેના માટે પૂ. નાથાભાઈએ દોડાદોડ કરેલી. આપણે ઈંટોની દીવાલ બનાવીએ એમ પૂળાની દીવાલ બનાવેલી. કુટીરોની દીવાલ પૂળાની તો બનાવી પણ તેમાંથી હવા તો આવેને. તેને રોકવા કંતાન બાંધવું એમ નક્કી થયું. શ્રી રમણભાઈ (અમારા ફોઈના દીકરા)

॥ સત્યધર્મ ગુરુદેવ કી જ્ય ॥

રૂતમ્ભરા

જુલાઈ-૨૦૨૩

૫

એ વખતે કરી ગામે એકજી.એંજી. હતા. તેઓશ્રીએ બારથી પંદર ગાંસડી કંતાન મોકલેલું. કાર્યક્રમ પતે પરત કરવામાં આવ્યું. કંતાન પેટીપેક હતું. તે કુટીરોમાં વપરાયું તેમજ આખી શિબિરની ચારે બાજુ કંતાનની દીવાલ કરવામાં આવી. મંડપ વગેરે પણ કંતાનનાં જ હતાં. રસોડામાં જમવા માટે, પાથરવા માટે પણ કંતાન જ હતું. શિયાળામાં કંતાનને લીધે ઠંડી ઓછી લાગે. કુટીરોનું કામ ચાલતું હતું તે દરમ્યાન ગુરુજીનો આંટો તો ખરો જ. શ્રી ગુરુદેવ જાતપાસ માટે અવારનવાર આવતા. શિબિરના કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં મને નથી લાગતું કે પૂ. શ્રીને અમારા જેટલી પણ નિદ્રા મળી હોય. સતત કાર્યકરત રહીને પૂ. શ્રીએ શિબિરનાં તમામ પાસાંઓનું અવલોકન કરેલું, સંભાળ રાખેલી.

સભામંડપ મોટો બનાવવામાં આવેલો. એક બાજુ કુટીરો અને બીજી બાજુ સભામંડપ તૈયાર થયો. સભામંડપના મુખ્ય દરવાજે ‘નિર્વિકલ્પ મુક્તિધામ’ નામ મુકવામાં આવ્યું. દરવાજે ગોળાકાર હતો. સભામંડપની બીજી બાજુ રસોડું તૈયાર કરવામાં આવ્યું. રસોડું પણ ખાસું મોટું હતું એક સાથે બસો (૨૦૦) બ્યક્સિને બેસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. કુટીરોની બાજુમાં પૂ. શ્રી માટે જાજરુ બનાવવામાં આવ્યું અને શિબિરાર્થીઓ માટે પણ અલાયદાં જાજરુ બનાવવામાં આવ્યાં. ગણતરી પ્રમાણે શિબિરની ચારે દિશામાં જાજરુ મૂકવામાં આવ્યાં. બાથરૂમ આઠેક બનાવ્યાં.

કૂવામાંથી નીકળતા તાજા પાણીની વ્યવસ્થા કરવામાં આવી જેથી જે ગરમ પાણીથી સ્નાન કરતા ન હોય તેમને ઠંડી ન લાગે. ગરમ પાણીની વ્યવસ્થા તો હતી જ.

ગામ થી શિબિરની જગ્યા સુધી ઓમ્ર ગુરુઓમ્રની ધજાઓ ફરકાવવામાં આવી જેથી અજાણ્યા

માણસને શોધવામાં તકલીફ ન પડે. ગામથી શિબિર સુધી નિશાનીવાળા બોર્ડ પણ મૂકવામાં આવ્યાં.

બહેનો માટે જાજરુ અને બાથરૂમ અલગ બનાવવામાં આવ્યાં હતાં. દરેકની મર્યાદાઓ સચ્ચાવાય તે રીતે બાથરૂમ અને જાજરુ કંતાન અને ઘાસના જ બનાવવામાં આવ્યાં હતાં.

ખેતરમાં પ્રવેશવા માટે દરવાજે બનાવવામાં આવ્યો. તેની નજીદીક મહેમાનો માટેનો વિભાગ બનાવ્યો. ભાઈઓ અને બહેનોના વિભાગ અલગ અલગ હતાં અને તેની થોડીક નજીક જાજરુની વ્યવસ્થા તો ખરી જ. મહેમાનોના વાહનો માટેની જગ્યા પણ નક્કી કરવામાં આવી. એક સાથે ત્રણસો ગાડી ઊભી રહી શકે તેટલી વિશાળ જગ્યા તૈયાર કરી. જરૂર પડે એસ.ટી, મેટાડેર માટેની પણ વ્યવસ્થા રાખેલી. શિબિરના સમય દરમ્યાન પૂ. ગુરુદેવના દર્શને જે આવે કે શિબિર જોવા આવે કે પછી શિબિરાર્થીઓને મળવા આવે તે બધાનું મહેમાન-કક્ષમાં સ્વાગત થતું, ભોજનના સમયે ભોજન અને પ્રસાદના સમયે પ્રસાદનો દરેકને લાભ મળતો અને આ સર્વે પૂ. શ્રીના આદેશના પાલન સાથે થતું. આ થઈ શિબિરાર્થીઓ માટે અને મહેમાનો માટેની વ્યવસ્થા.

રસોડું શ્રી ગંગારામભાઈ પુરોહિતને સૌંપવામાં આવ્યું. રસોડાના માસ્ટર ગણાતા શ્રી ગંગારામભાઈ પૂ. શ્રીના પ્રિય પાત્ર હતા. તેમની રસોડું પૂજ્યશ્રીને અનુકૂળ આવતી. ગંગારામભાઈની કાર્યશક્તિ અને ભાવના અવર્ણનીય હતી. ‘નિર્વિકલ્પ મુક્તિધામ’ માં કોઈપણ જાતના વ્યસનની છૂટ નહોતી. એટલે કે ચા-પાણી, કોઝી, બીડી, સીગરેટ વગેરેની છૂટ નહોતી. મહારાજ (રસોડ્યા)ને તો આ બધું જોઈએ જ. ઠંડીના વાતાવરણમાં ખાસ જોઈએ. પણ ગંગારામભાઈ ચુસ્ત

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને તેમની જગ્ય તો જ આપણી જગ્ય ॥

રીતે નિયમપાલન કરાવતા. બધાં જ રસોઈએ અને મદદનીશ સર્વ જાતના વ્યસનથી મુક્ત રહેતા. આ બધાના કારણે દસ દિવસમાં લગભાગ ગ્રાસ ટુકડીઓ બદલાણી. એકવખત રાત્રીના બાર વાગે રસોઈએ જતા રહ્યાં આથી અમે ગંગારામભાઈને ગાડી આપી અને તેઓ સવારના ચાર વાગે બીજી આખી ટુકડી લઈને હાજર થઈ ગયા. જો રસોયો એમ કહે કે મારે ચા-બીડી વગર નહીં ચાલે તો ગંગારામભાઈ કહે મારે તારા વગર ચાલશે. અને હકીકતમાં તેના વગર તેઓ ચલાવી લેતા. આવું હતું તેમનું જવાબદારીભર્યું કાર્ય. જવાબદારી સંભાળ્યા પછી તેનો તેઓ સંપૂર્ણ મક્કમતાથી નિભાવી જાણો. પોતે જાતે બ્રાહ્મણ હતા. ઈન્કમટેક્ષમાં નોટીસ-સર્વર તરીકે ફરજ બજાવતા.

ગંગારામભાઈ નું રસોદું એકદમ ચોખ્યું હોય. કોઈપણ વ્યક્તિ પગરખાં પહેરીને રસોડામાં જઈ ન શકે. રસોદું શરૂ કરે તે પહેલાં પૂર્ણ શ્રદ્ધાથી ચોખ્યા ઘી નો દીવો કરે અને રસોદું પતે નહિ ત્યાં સુધી દીવો પ્રગટેલો જ રાખે. રસોઈ પૂર્ણ થાય એટલે પૂ. ગુરુદેવને કે અન્નદેવને અર્પણ કર્યા સિવાય રસોઈને અડકવા દેતા નહીં. કોઈને ભૂખ લાગી હોય તો તેની અને નાનાં બાળકોની દૂધની વ્યવસ્થા તેઓ રાખતા. બાળકનું દૂધ મા ભૂલી જતી પણ ગંગારામભાઈની પાસે હોય જ અને તે પણ ચોવીસ કલાક.

તેઓ શિબિર દરમ્યાન સવારે સાડાત્રણ વાગે ઉઠે, ભંડા પર મોટું તપેલું ચઢાવે અને તેમાં પાણી જાતે ભરે. ઓછામાં ઓછી વીસ ડોલ પાણી ભરે. ખૂબ જ ગરમ રાખે એટલે અડધી ડોલ ગરમ પાણીમાંથી બે ડોલ પાણી થાય. શિબિરાર્થીઓને જોઈએ તેટલું પાણી અને બીજું પાણી જાતે જ ઉમેરે. પ્રસાદ લગભગ છ વાગે લેવાય ત્યાં સુધી તેઓ ગરમ પાણી માટે જાતે જ ઉભા

રહે. સ્નાન કરવા માટે શિબિરાર્થીએ મહેમાનને ઈચ્છા થાય તેટલું ગરમ પાણી મળતું.

સવારે છ થી સાતમાં દૂધની પ્રસાદી અપાતી. લગભગ ૨૦૦ મી.લી. જેટલું દૂધ અપાતું. સવારે ગરમ શીરાની પ્રસાદી અપાતી પણ શિબિરાર્થીઓની વિનંતી અને પૂ. ગુરુદેવના આદેશથી એ રદ કરેલી. દૂધ પછી બપોરે લગભગ ૧ થી ૨માં બપોરનો ભોજન-પ્રસાદ લેવાતો. રાત્રે ૭ થી ૮માં રાત્રીનો પ્રસાદ લેવાતો. બપોરે લગભગ ૨૦૦ થી ૨૫૦ અને રાત્રે ૧૫૦ થી ૨૦૦ માણસો પ્રસાદ લેતા. શિબિરાર્થીસાથે કોઈપણ મહેમાન હોય કે કોઈપણ અગ્રણી વ્યક્તિ હોય તેમને પ્રસાદના સમયે પ્રસાદ લેવાનો વિનંતીપૂર્વક આગ્રહ કરાતો અને દરેક વ્યક્તિ પ્રસાદ લઈને જ જતી.

રસોઈમાં પૂ. ગુરુદેવના આદેશ મુજબ પૌષ્ટિકતાને અશ્રીમતા અપાતી. ઘી, માખણ, દૂધ વધારે વાપરવાની કોશિશ થતી. તળેલા, તીખા, ઓછા, લસણ, હુંગળી, આમલી વગરે વપરાતા નહીં શાકભાજી પણ એવાં પસંદ કરાતાં જે પચવામાં સહેલા હોય. આવું હતું ગંગારામભાઈની દેખરેખ નીચેનું રસોદું.

કુટીરોના ખાનિંગ અને બાંધકામ માટે પૂ. શ્રી મંગળભાઈ અને પૂ. શ્રી દાસભાઈ (પુરુષોત્તમદાસ) અને અમારા મોટાભાઈ. એમાંના દાસભાઈ અમુક રીત રિવાજોમાં ઓછું માને. એમણે જોયું કે શિબિરની શરૂ થવાની તારીખ નજીક આવી રહી છે અને એટલા સમયમાં કુટીરો બંધાશે નહીં. તેથી દાસભાઈએ ઓફિસમાં રજાઓ મૂકી દીધી અને રાતદીન ખેતરમાં જ રહીને કુટીરો બંધાવાનું કામ પોતાના હસ્તક લઈ લીધું. તેઓ ખાનિંગ પ્રમાણે કુટીરો બંધાવી તેમજ શિબિરની જરૂરિયાત પ્રમાણે બંધાયું ત્યાં સુધી હાજર રહ્યા. આ છે મોટાભાઈનો પોતાના નાના ભાઈ પ્રત્યેનો

॥ સત્યધર્મ ગુરુદેવ કી જ્ય ॥

રૂતભરા

પ્રેમ. કોઈક કહ્યું કે તમે આવા બધામાં માનતા નથી અને આ તમે જ બનાયું એટલે તમે માનો છો. ત્યારે પૂ. દાસભાઈએ જવાબ આપેલો કે હું માનું કે ન માનું પણ મારો ભાઈ તો માને છે ને? મારા નાના ભાઈએ આ કામ ઉપાડ્યું છે એટલે એ કામ સમયસર પૂરું ન થાય તો તેની આબરૂ જાય અને તેની આબરૂ જાય તેની આબરૂ જાય એટલે મારી જ ગયેલી છે ને? આવા પૂ. મોટાભાઈ ને વંદન.

કુટીરો બાંધવાની શરૂઆત થઈ. ખાનિંગ પ્રમાણે થાંભલીઓ ઊભી કરવામાં આવી. અને અંદર ઓટલા બનાવવામાં આવ્યાં. ઓટલાઓનું લીપણ પૂ. મોટીબેન ડાહીબેન તથા હીરાબેને સંભાળ્યું સાથે કુટુંબની અન્ય બહેનોનો સહકાર તો ખરો જ. અમારા કુટુંબના એટલે કે અમથાબાપાનાં દીકરા-દીકરીઓ-જમાઈઓ-પૌત્રો-પૌત્રીઓ તથા પૂ. કરસનકાકાનાં પુત્રો-પુત્રીઓ એક અવાજે અને એક જ નેતૃત્વ હેઠળ રાત-દિવસ કામ કરવા લાગ્યાં પોતે ભાઈ છે કે દીકરો છે કે વહું છે કે દીકરી છે કે જમાઈ છે એવા સર્વ પ્રકારના અહીં છોડીને સૌ કામે લાગી પડેલાં. આ લખીએ છીએ ત્યારે અમારી આંખમાંથી અશ્વધારાઓ વહી રહી છે. અમે અત્યારે વિચારીએ છીએ કે અમે આટલા બધા પ્રેમના અવિકારી હતી? કે પૂ. શ્રીનો પ્રેમ હતો? કે પૂ. શ્રીની કૃપા હતી? આમ તો અમે પ્રથમથી જ આખા કુટુંબના બહુજ લાડકા હતા અને છીએ. આ પ્રેમ જાળવી રાખવા માટે પૂ. ગુરુદેવને પ્રાર્થના કરું કે અમને સૌને સાચી સમજણ આપે. આજે અમારા બા છન્નુ વર્ષનાં છે અને અમને પણ સત્તાવન વર્ષ થયાં છે તોય અમે બાના ખોળામાં માણું મુંકીને આજે પણ સૂઈએ છીએ અને અનેરો આનંદ પ્રાપ્ત કરીએ છીએ. આ બધો પૂ. શ્રીની કૃપાનો પ્રભાવ છે. આખા ખેતરમાં પૂ. બાલચંદ્રભાઈ (અમારા

દાદા) નો પરિવાર પથરાયો હતો, અને તેમના દ્વારા સંશિષ્ટ કામ આગળ વધે જતું હતું.

કુટીરોના થાંભલા ઊભા થયા. ઓટલા લીપાઈ ગયા. હવે આજુભાજુ અને ઉપર ઘાસ પાથરવામાં આવ્યું. ઘાસ બાંધવાનું અને ઉપર નાખવાનું કામકાજ પૂ. નાથભાઈ અને પૂ. કાકાશ્રીના નેજ હેઠળ હતું. કુટીરોને ઘાસની દીવાલો થયા પછી કંતાન બાંધવામાં આવ્યું. ઘાસની વચ્ચેની જગ્યામાંથી પવન ન આવે અને ડિસેઝરની જોરદાર હંડીથી બચાય તે માટે કંતાન બાંધવામાં આવ્યું. કુટીરની અંદર ખાટલા પાથરવામાં આવ્યા. ખાટલામાં બે ગાઢલાં અને બે ઓઢવા માટે એમ દરેક કુટીર ખાતે ચાર ગાઢલાં આપવામાં આવ્યાં. દરેક કુટીરમાં પૂર્વ દિશામાં ગાયત્રી મંત્ર (ધાપેલો) કે જે પાંચેક ફૂટ દૂરથી આરામથી વાંચી શકાય તેવી રીતે ટીગાળવામાં આવ્યો. કુટીરને ઘાસનો દરવાજો કરવામાં આવ્યો જેથી આરામથી બંધ કરી શકાય. દરેક કુટીરના પાંચ ફૂટ થાંભલા ઊંચા હતા જેની પર ઓમ્ભુ ગુરુ ઓમ્ભુની ધજાઓ ફરકે. દરેક ધજાને એક એક સળિયામાં પરોવીને બાંધવામાં આવી. ચાર કુટીર વચ્ચે નાના ચોક જેવું પડતું. કુટીરોના ખાન પરથી તેનો અંદાજ આવશે. આ હતી કુટીરની વ્યવસ્થા-રચના.

પૂ. શ્રીની કુટીર બીજી કુટીરો કરતાં અલાયદી હતી. પૂ. શ્રીને સૂવા ઉપરાંત બીજા પાંચ સાત માણસો અંદર બેસી શકે તેવી કુટીર હતી. પૂ. શ્રીની કુટીરમાં ખાટલાને બદલે મોટી પાટો મૂકવામાં આવી હતી જે પાટ ૬/૨' ૪' ની હતી એટલે કુટીરનું માપ લગભગ ૧૬' ૧૧' નું હતું. પૂ. શ્રી આ કુટીરમાં રહીને શિબિરનું સંચાલન કરતા. સંચાલન જ નહીં પણ નાનાં-મોટા સર્વેનું સાવધાનીપૂર્વક ધ્યાન રાખતા. પૂ. શ્રી પોતાનું નાનું-મોટું કામ જાતે જ કરતા.

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને તેમની જય તો જ આપણી જય ॥

સભામંડપ પણ ખાસ્સો મજાનો મોટો હતો. કુટીરોમાં જવા માટે સભામંડપમાં થઈને જવાતું ૮૦' ૪૦' લગભાગ માપ હતું. સ્ટેજ પણ પાટોનું જ બનાવેલું હતું. સ્ટેજ પર પૂ. શ્રીની મોટા કદની છબી હતી અને છબીની બંને બાજુ ઓમ્ભુ નારાયણની છબી હતી એટલે ઓમ્ભુ ગુરુ ઓમ્ભનો મંત્ર બનતો હતો. (ॐ + ગુરુદેવનો ફોટો + ॐ) = ઓમ્ભુ ગુરુ ઓમ્ભ.

સભામંડપમાં પ્રથમથી જ પાણી છાંટીને ધૂળા ન ઉતે તેની કાળજી લેવાઈ હતી. છેલ્લા દિવસે એટલે કે શિબિર શરૂ થયાના આગલા દિવસે સભામંડપને સાફ કરવા માટે પૂ. શ્રીએ સાવરણો પોતાના હાથમાં લીધો હતો અને જાતે જ સાવરણાથી સાફ-સૂઝી કરી હતી. પૂ. શ્રી આવી જ રીતે સૂક્ષ્મ સાવરણાથી આપણા તન-મનમાં રહેલો કચરો સાફ કરે છે જેનો આપણને અંદાજ પણ આવતો નથી, આપણને ખબરેય પડતી નથી.

દર રવિવારે બપોર પછી ગુરુજીની સાથે પલિયડ જતા. પલિયડના આ બધા કાર્યક્રમ દરમ્યાન ગુરુજીએ એક પ્રાર્થના અને ભજનની રચના કરી જે આજે પણ સ્વાધ્યાયમાં આપણે સૌ પ્રાર્થનાના રૂપમાં ગાઈએ છીએ.

સભામંડપનાં છજાંથી બધા થાંભાલા ઊંચા કાઢેલા હતા અને તેની પર મોટી ધજાઓ ફરકાવેલી હતી.

આમ શિબિરની કુટીરો અને સભામંડપની ધજાઓ, થોડોક પવન આવતાં ખૂબ રમણીય લાગતી. થોડાક પવનમાં ફરકતી ધજાઓ જાણે ઓમ્ભુ ગુરુ ઓમ્ભના મંત્રનું લખાણ અને વાચિક જાપ કરતી હોય તેવું લાગતું. આ દર્શય જોઈ મનના તમામ ઉચ્ચાટ સમી જતા અને મનના ઉચ્ચાટ સમે પછી અંદરનો જે આનંદ ઊભરાય તેનું તો વર્ણન કેવી રીતે કરવું! વર્ણન(શર્જદોમાં) કરવાથી સર્વે અધૂરું ભાસે.

પલિયડ ગામના ગોંદરેથી (નિર્વિકલ્પ મુક્તિધામ) સુધી રસ્તાની બંને બાજુ ઓમ્ભુ ઓમ્ભની ધજાઓ ફરકતી હતી તથા રસ્તાની બંને બાજુ શિબિરના સ્થળે જવા દિશા સૂચક ચિહ્નનો મુકાયાં હતા. અજાણી વ્યક્તિને બસમાંથી ઉત્તર્ય પછી શિબિર સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરાઈ હતી. આમ ગુરુદેવની કૃપાથી શિબિર માટેની કુટીરો, મંડપ, સ્ટેજ, જાજરુ-બાથરુમ તથા પાર્કિંગની વ્યવસ્થિત, પ્લાનિંગ પ્રમાણે રચના થઈ. છપાવેલ પત્રિકાઓથી આમંત્રણ અપાઈ ગયાં. વળતા જવાબ પણ આવવા લાગ્યાં, કોણ કેટલા દિવસ જાપમાં બેસવાનો લાભ લેશે તે પણ નક્કી થઈ ગયું. કુલ કેટલા સાધકો લાભ લેશે તેનો અનુક્રમ તેચાર થઈ ગયો. આ તમામે કામ પૂ. ગુરુદેવે સ્વહસ્તક રાખીને વ્યવસ્થિત રીતે કર્યું હતું. પૂ. શ્રીએ બધાંજ અરજીપત્રકો પોતે જ તપાસ્યાં હતાં.

શિબિરમાં લાભ લેનાર શિબિરાર્થીને નીચેની વસ્તુઓ લાવવાની હતી.

1. નાનો બિસ્તરો
2. પોતાનો ઘાલો, નાની ડિશ, ચમચી, ચપ્પુ, નાનીકાતર, સોય વગેરે
3. પોતાની માળા, પેન્સિલ, નોટબુક વગેરે
4. ગરમ આસન
5. ગોમુખી તથા નાની વોટરબોટલ
6. પોતાનાં બે થી ત્રણ જોડ કપડાં, ટુવાલ, નેપક્રિન વગેરે
7. નાની બેગ, અરીસો, દાંતિયો.

શિબિરાર્થીઓ માટેનો કાર્યક્રમ પણ પૂ. ગુરુદેવશ્રીએ બનાવ્યો હતો જે યાદ આવે છે તે નીચે પ્રમાણે છે.

॥ સત્યધર્મ ગુરુદેવ કી જ્ય ॥

રૂતભરા

૧. ૪ થી ૬-સવારે-નિત્યકમ
૨. ૬ થી ૬-૩૦ પ્રાર્થના
૩. ૬-૩૦ થી ૭-૦૦ હળવો નાસ્તો
૪. ૭ થી ૮ પ્રભાત ફેરી કે તેવો કોઈ કાર્યક્રમ
૫. ૮ થી ૧૨ જાપ
૬. ૧૨ થી ૩ આરામ, પ્રસાદ
૭. ૩ થી ૭ જાપ
૮. ૭ થી ૮ સાદું ભોજન
૯. ૮ થી ૧૦ પાતંજલ યોગદર્શન પર પ્રવચન
૧૦. ૧૦ થી ૫ શયન

ઉપરના કાર્યક્રમમાં સમયાનુસાર જાપ સિવાયમાં ફેરફાર થતો. ઘણી વખત રાત્રે પણ પદ્યાત્રા થતી.

શિબિરાર્થીએ પાળવાના નિયમો.

૧. કોઈપણ જાતનું વ્યસન-કોફી-ચા-બીડી વગેરે-બંધ
૨. શિબિરાર્થીએ સમય પ્રમાણે વર્તવું ફરજિયાત.
૩. સાત્ત્વિક ભોજન

તા.૨૧ મી ડિસેમ્બરે લાભ લેવા ઈચ્છતા સર્વે શિબિરાર્થીઓ આવી પહોંચ્યા. દરેકને પોતાની કુટીર સોંપાઈ અને કાર્યક્રમની રૂપરેખા અપાઈ. નૈસર્જિક વાતાવરણમાં પગ દેતાં જ આનંદ થતો. પૂ. શ્રીની હાજરી માત્રથી વાતાવરણ ઓર નૈસર્જિક લાગતું. રાત્રે પ્રાર્થના કરી ઓમ્ભૂ નારાયણની ધજા ફરકાવી સર્વે શિબિરાર્થીઓ પોતાની કુટિરમાં આરામ કરવા ગયા.

૨૨ મી ડિસેમ્બરે સવારે ખુદ ગુરુજ પણ પાંચ વાગે તૈયાર હતા. નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે સૌ ગુરુદેવની કુટિર સામેના ચોકમાં, જ્યાં લગભગ વીસેક ફૂટ ઊંચે ઓમ્ભૂ નારાયણની ધજા ફરકતી હતી, ભેગા થયાં. કાર્યક્રમની પ્રાર્થના સાથે શરૂઆત થઈ. પ્રાર્થના

પછી પૂ. ગુરુદેવે આશીર્વચન આપતાં શિબિરના કાર્યક્રમની રૂપરેખા આપી તથા શિબિરનો અર્થ સમજાવ્યો. શિબિરાર્થીએ કેવી રીતે વર્તન કરવાનું છે તે સમજાવ્યું. પૂ. શ્રીએ જણાવ્યું કે રસોઈયો રસોઈ બનાવે, બનાવેલી સુંદર વાનગીઓ પીરસે અને કદાચ તે આપણાં મોંમા મૂકે પણ આપણે તે ગળે ઉતારીએ નહીં તો રસોઈયો શું કરે? નસીબ આપણાં?

આમ સવારના આશીર્વચનમાં જીવન જીવવા કામ લાગે તેવું કાંઈકને કાંઈ દરેકને મળતું. પ્રાર્થના વખતે જ પૂ. ઓમ્ભૂ ભગવાનની આરતી ઉતારવામાં આવતી. કોઈને પણ આરતીમાં કે ગમે ત્યાં પાઈપેસો ન મૂકવાની વિનંતી કરાઈ હતી. દસેદસ દિવસમાં દરેક દરેક દિવસની સવારે પૂ. ગુરુદેવ પાસેથી આશ્રષ્ટ-પ્રસાદ રૂપે કાંઈક નવું જ મળતું, જેનાથી મન તૃપ્ત થતું.

૬-૩૦ થી ૭માં દૂધ અપાતું, મસાલાવાળું દૂધ શ્રી ગંગારામભાઈ ઘણી વખત સ્વહસ્તે પીરસતા. ગરમ ગરમ દૂધ પીને શિબિરાર્થીઓ પાછા એકઠા થતા અને પ્રભાતફેરી નીકળતી. દરરોજે દરરોજ જુદી જુદી ધૂનો સાથે બેતરમાંથી ગામમાં અને ગામમાં પણ આભા ગામની ફરતે તથા મંદિર-મહાદેવમાં દોકડ, મંજુરા વગરે સાથે ધૂન બોલતી. એકદમ તાલમાં બોલતી અને નિત્ય નવી ધૂનો બોલતાં ગામ લોકોને ખૂબજ આનંદ થતો. અને અમને તો જે આનંદ થતો તેનું વર્ણન થઈ શકે તેમ નથી. મને યાદ છે ત્યાં સુધી ચાલુ ધૂને મને એક માજીએ બહાર બેંચી કાઢીને માથે ચુંબન કર્યું હતું અને આશીર્વાદ આપતાં બોલ્યાં હતા કે ધન્ય છે તારા માતાપિતાને. તારે કારણે આવા સંત શિરોમણીના દર્શન કરી અમે ધન્ય થઈ ગયાં. આટલી નાની ઉભરમાં તે પોતાના જીવનનું કલ્યાણ કરવાની તક જડીધી છે તે તારા સંસ્કાર અને તને ધન્ય છે. આટલું સાંભળી હું ખૂબ જ

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને તેમની જય તો જ આપણી જય ॥

ખુશ થયો. મારા ગુરુજીની કદર થઈ રહી છે તે સાંભળી હું અનેરા આનંદમાં આવી જતો. ગામ લોકો પણ પ્રભાતરેનીમાં જોડતા.

પ્રભાતરેની પત્યા પછી સર્વ જાપમાં બેસી જતા. જાપમાં બેઠા પછી શિબિરનું વાતાવરણ એકદમ શાંત લાગતું. તેટલા સમય માટે પક્ષીઓ પણ ચૂપ રહેતા લાગતાં, રસોડામાં પણ અવાજ એકદમ ઓછો થતો. જાપ દરમ્યાન સર્વ પોતાનાં કામકાજ શોર બકોર વગર કરી લેતાં. દરેક શિબિરાર્થી કેટલા જાપ કરે છે તે પોતાની નોટબુકમાં નોંધતા. શિબિરાર્થીઓ લગભગ બારેક વાગે બહાર નીકળતા. દરેક કલાકે ઘંટ વગાડવામાં આવે તેથી સમયનો અંદાજ આવે.

બાર વાગ્યા પછી જે કોઈ સવારના નિત્યકમથી વંચિત હોય તે પતાવતા. સવારે ઠીમાં સ્નાન ન કરી શક્યા હોય તેઓ સ્નાન કરતા, કપડાં ધોઈ લેતા અને જેઓને સભામંડપમાં અથવા પોતાની કુટીરમાં ધ્યાનમાં બેસવાની ઈચ્છા હોય તેઓ તેમ કરતા. મારા જેવા ઉંઘતા.

બપોરના પ્રસાદના સમયે ઘંટ વાગતાં જ સૌ પોતાના ખાલા લઈને આવી જાય. આ પહેલાં શ્રી ગંગારામભાઈ પૂ. ગુરુદેવનો પ્રસાદ જાતેજ લઈને જતા. એમનો પ્રસાદ નીકળ્યા પછી જ પ્રસાદ લેવાનો ઘંટ વાગાડતા. સર્વ શિબિરાર્થીઓ હરોળમાં બેસીને પતરણા-દઢિયામાં પ્રસાદ લેતા. પતરણા, દઢિયા, પ્રસાદ ક્રમબધ્ય પિરસાતું. સર્વ પિરસાઈ રહ્યા પછી જય બોલાતી. પીરસવાનું ચાલુ હોય ત્યારે ધૂન બોલાતી. જય બોલાયા પછી જ સર્વ શિબિરાર્થી પોતાનો પ્રસાદ લેવાનું શરૂ કરતા ઉપવાસવાળાને, મોળું ખાનારને કે અનુષ્ઠાન કરનારને તે જ પ્રમાણે વ્યવસ્થા થતી. ભોજન પતાવ્યા પછી દરેક વ્યક્તિ પોતાની પતરણી નિયત થયેલી જગ્યાએ મૂકી આવતા. પછી પોતપોતાની કુટિરમાં આરામ કરતા.

કોઈક પાછા કપડાં, સ્નાન વગેરે પતાવતા. લગભગ પોણા ત્રણેક વાગે પાછી દોડાડોડ થતી અને ત્રણ વાગ્યાનો ઘંટ વાગતાં સર્વ શિબિરાર્થીઓ પાછા પોતાની કુટીરોમાં ગોઠવાઈ જતા અને પછી એક ચિત્તે જાપ કરતા. પાછા છ થી સાતના ગાળામાં સર્વ સાયં-પ્રાર્થના માટે કુટીરો વચ્ચે આવેલા ખુલ્લા ચોકમાં એકઠા થતા. જ્યાં સાયંપ્રાર્થના કરી પૂ. શ્રીના આશીર્વદન સાંભળી સર્વ ફરવા નીકળતા. ઘણી વખત પૂ. ગુરુદેવ જાતે જ જુદા જુદા રસ્તે ફરવા લઈ જતા.

વચ્ચેના સમય દરમ્યાન પૂ. શ્રી પોતાની કુટિરમાં બેઠા બેઠા પોતાનાં કામ જાતે જ કરતા. શિબિર દરમ્યાન પૂ. શ્રીએ એક ક્ષાણનો આરામ કર્યો હોય તેવું લાગતું નથી.

રાત્રીના ભોજનનો ઘંટ વાગતાં બધા શિબિરાર્થીઓ રસોડે હાજર થઈ જતા. ઘણા શિબિરાર્થી એક સમય જમતા. તેઓને દૂધ કે છાશનો પ્રસાદ અપાતો. રાત્રી ભોજન પતાવ્યા પછી સૌ સભામંડપમાં એકઠા થતા જ્યાં પૂ. શ્રી પાતંજલ યોગદર્શન પર પ્રવચન આપતા.

જાપ દરમ્યાન મને ઉંઘ આવતી એટલે જાપનો પૂરો લાભ મળતો નહીં, છતાં લાભ લેવાની પૂરી કોશિશ ચાલુ હતી. પૂ. શ્રી જાપના સમય દરમ્યાન દરેક દરેક કુટીરે આંટે મારતા, કોણ ઉંઘે છે તેનું ધ્યાન રાખતા. જાપ દરમ્યાન પૂ. શ્રી ચારે બાજુ આંટા મારી બાકીનું પણ પોતાની નજર તળે રાખતા. ઘાસ અને કંતાનથી બનાવેલી કુટીર કેટલી જોખમી છે તેનો અંદાજ આવવો મુશ્કેલ છે. જેની સતત ચિંતા પૂ. શ્રી કરતા અને કોઈપણ જાતાનું અજુગતું ન બને તેની કાળજી રાખતા. પોતાના પિતા પણ પોતાનાં બાળકોને વહેતા મૂકી આરામ કરે છે. પણ આ તો પિતાનાય પિતા!

॥ સત્યધર્મ ગુરુદેવ કી જય ॥

રતભરા

રાત્રે પાતંજલ યોગદર્શન પરનાં પ્રવચનો સાંભળવા ગામલોકે પણ આવતા અને લાભ લેતા. જે દિવસે પ્રવચન ન હોય તે દિવસે ભજનોની રમજટ ચાલતી. કોઈપણ કાર્યક્રમ રાત્રીના દસ વાગે બંધ થતો અને સર્વે શયન માટે પોતાની કુટીરોમાં ગોઠવાતાં. ખૂબ જ હંડીના કારણે સર્વે ગાદલામાં લપાઈ જતા. રાત્રે ૧૦ થી સવારના પ વાગ્યા સુધી શયન થતું.

શિબિર અને શિબિરાર્થીઓના રક્ષણ અર્થે દર આઠ કલાકના અંતરે ફરજ (પહેરો) ગોઠવવામાં આવ્યો હતો. આના મુખ્ય સંચાલક શ્રી બાબુભાઈ દેસાઈ હતા. બાબુભાઈ શિબિર શરૂ થઈ ત્યારથી જ રાત-દિવસ ખેતરમાં જ રહેતા. કોઈપણ જાતની મહેનતથી થાકતા નહીં. અમદાવાદ તેમનું નામ હતું. શિબિર પૂરી થયા પછી પણ બાબુભાઈ દસ દિવસ ખેતરમાં જ રહ્યા હતા.

કોઈ તો શિબિરમાં વેપારી-વૃત્તિથી આવતા હોય છે. તેઓ સીધા-સાદા માણસોને ફસાવવાની, ઊંધા માર્ગ દોરવાની કોશિશ કરતા હોય છે. પણ પ.પૂ. ગુરુદેવ ચોવીસ કલાકની સાવધાનીએ રક્ષણ કરતા હોય છે. કોઈ વળી ભ્રમો અને વહેમો ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ થોડાક માણસોને લઈને તેનો પ્રયત્ન કરતા, પણ પ.પૂ. ગુરુદેવની જાગતી ચોકીના કારણે તેઓ કોઈ સફળ થઈ શકતા નહીં. વહેમો અને ભ્રમોનું તો “ભ્રમણાભૂતના ભૂક્કા બોલાવનાર” પ.પૂ. ગુરુદેવની હાજરી માત્રથી જ મોત થઈ જાય. પ્રેમ અને કરુણાના સાક્ષાત્ સ્વરૂપ પૂ. ગુરુજીના ચરણોમાં છેવટે જે ભાઈએ પ્રયત્નો કર્યા પણ સફળ ન થયા તે સૌ જૂકી જાય ! પારસમણિના સ્પર્શથી લોહું પણ સોનું બની જાય !

એક વખત એક શિબિરાર્થીએ ઘેર જવાની રજા માંગી. કારણ પૂછ્યાં જાણવા મળ્યું કે તેઓને પ્રસાદ પ્રતિકૂળ છે. એમને તે તકલીફ દૂર કરવાની ખાત્રી

મળતાં પાછા વધ્યા. પણ બીજા દિવસે કોઈને પણ પૂછ્યા વગર ચિઠ્પી મૂકીને જતા રહ્યા.

એક વખત સાંજના સમયમાં અમારા અનુજ ભાઈશ્રી અરવિંદભાઈ ફરજ પર હતા. મહેમાનક્ષ દરવાજાની આગળ જ હતો. તેમાં પણ સૂવા, બેસવાની સગવડ હતી. ભાઈઓ તથા બહેનો માટે અલગ વ્યવસ્થા હતી. તેઓ ફરજ પર હતા ત્યારે એક ભાઈ આવ્યા. તેઓની રીતે દાદાગીરી કરવા લાગ્યા. આવતાંની સાથે હુકમથી “ગુરુજીને મળવું છે” એમ જણાવ્યું. અરવિંદભાઈએ નમ્રતાથી સમજાવ્યું કે ગુરુજી અત્યારે જાપમાં છે. અને તેઓએ અત્યારે મળવાની ના પાડી છે. અત્યારે તેમે મહેમાન કક્ષમાં બેસો. વધારે પડતા તેમના હઠાત્રથી અરવિંદભાઈ બિજાયા અને જણાવી દીધું કે ગુરુજીની આજ્ઞાનું સંપૂર્ણ પાલન થશે, પછી ગમે તે થાય અને આપ ગમે તે હો. અવાજ આવતાં પૂ. શ્રી બહાર આવ્યા અને મામલો થાળે પાડ્યો.

દરરોજ કેટલા મંત્ર થયા તેનો સરવાળો થતો. પછી યજંકુંડ તૈયાર કરવામાં આવ્યો. છેલ્લા બે દિવસ લગભગ આઠેક કલાક આહુતિ આપવામાં આવી. છેલ્લા દિવસે યજનો કાર્યક્રમ ગોઠવાયો. ઓમ્ર પરિવાર ના યજ્ઞો થાય છે તેવો યજ થયો. કુંઠબના એક એક સત્યને આહુતિ આપવાની તક આપી. બધા સત્યોએ આનો ઉમળકાબેર લાભ લીધો અને આનંદવિભોર બન્યાં. પૂર્ણાહુતિએ સત્સંગસભામાં દરેક શિબિરાર્થીનિ પ.પૂ. ગુરુદેવની છબી પ્રસાદમાં આપવામાં આવી. બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા પણ આપી. સૌ તરફથી શિબિરનાં ખૂબ વખાણ થયાં. પ.પૂ. ગુરુદેવના હસ્તે આશિષ-અભિનંદન-પત્ર અમથાબાપા-પરિવારને આપવામાં આવ્યું.

આમંત્રિત મહેમાનોમાં શ્રી રવુભાબાપુ (બકરાણાવાળા) મુખ્ય હતા. તેઓએ તથા પત્રકારોએ

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને તેમની જય તો જ આપણી જય ॥

આ શિબિરનું “સત્યુગની શિબિર” તરીકે વર્ણન કર્યું હતું. તેઓને પૂછ્યું કે આ શિબિરને “સત્યુગની શિબિર” કઈ રીતે કહી ? જવાબ મળ્યો કે: “શિબિર નિમિત્ત શિબિરાર્થીઓ પાસેથી એક પાઈ પણ લેવામાં આવી નથી અને શિબિરમાં ચારે બાજુ બોર્ડ મૂક્યાં છે કે -શિબિરમાં કોઈએ કયાંય પાઈ-પૈસો વગેરે મૂકવા નહિ, આવી શિબિર તો સત્યુગમાં જ સંભવી શકે. અત્યારે તો ગ્રાનિટિસની શિબિર હોય તોય ખાસ્સી એવી રકમ ભરવી પડે છે. શિબિરનું આપું વાતાવરણ પણ ઋષિમુનિઓના આશ્રમ જેવું સાત્ત્વિક અને પવિત્ર છે.”

તે દિવસના આમંત્રિત મહેમાનો સાથે શિબિરાર્થીઓ પ્રસાદનો લાભ લીધો. આજે ભોજનમાં મહાપ્રસાદ હતો. શિબિરાર્થીઓ સાથે આમંત્રિત મહેમાનો, તેઓનાં ભિત્રમંડળ અને સગાં-સંબંધી સર્વેને મહાપ્રસાદનો લાભ મળ્યો. મહાપ્રસાદની સાથે શિબિરની પૂર્ણાઙ્કૃતિ થઈ.

હવે અધરામાં અધરં કાર્ય આવ્યું. વિદાયનું! દરેકને ઘેર જવાની ઉતાવળ હોય પણ શિબિરાર્થીઓને ઘરે જવાની સહેજ પણ ઉતાવળ નહોતી. કહે છે ને કે મોટો કાર્યક્રમ કરવો સહેલો છે પણ નાની લાગતી વિદાય અધરી છે, કારણકે વિદાય હુંમેશા વસમી લાગે છે. દસ-દસ દિવસ સુધી સાથે રસ્યા-જમ્બા, પૂ. ગુરુદેવના સાનિધ્યમાં આધ્યાત્મિક લાભ લીધો, હવે આવી વિદાય કોને ગમે? પૂ. શ્રીના સાનિધ્યમાંથી કોઈને જવું ગમતું નહોતું. પૂર્યશ્રીને છેડવાનું કોઈને પસંદ નહોતું. વિદાય વખતે એક પણ શિબિરાર્થી એવોનહોતો કે જેની આંખમાં આંસુન હોય. સર્વેએકબીજાને બેટા અને રડી પડતા. વિદાયના દુઃખના અને હર્ષના આંસુ એક સાથે વહી રહ્યા હતાં. આટલા દિવસ સાથે મળીને, સાથે રહીને જે આનંદ કર્યો આધ્યાત્મિક લાભ લીધો, પ. પૂ. ગુરુદેવના સાનિધ્યમાં રહીને જે આનંદ મેળવ્યો તેનાથી વિમુખ

થતાં કેને દુઃખ ન થાય? હવે દરેકને ગુરુજીની હાજરીથી દૂર જવું પડતું હતું. પણ જ્યાં સ્વાધ્યાય થતો હોય, નીતિ-નિયમથી જીવન જીવાતું હોય, સાચી સમજજીના શિખરો ચઢાતાં હોય ત્યાં ગુરુજીની હાજરી હોય જ. આવી ભાવના વિકસાવવા માટે જ આ બધા મોટા કાર્યક્રમોની જરૂર પડે છે. પૂ. શ્રી સૂક્ષ્મ રીતે હાજર છે એમ વિચારીને આપણાં કાર્યો કરતા રહીએ તો આપણને આનંદ જ આનંદ વર્તાય અને જીવનની સિદ્ધ્ય પણ હાથ-વેંતમાં જ મળે. અને જેનામાં આવી ભાવના જાગે તેનો સંપૂર્ણ વિકસ થઈ ગયો સમજો.

અમારાં સદ્ગ્રામ્યે પ. પૂ. ગુરુદેવ પલિયડ ગામમાં પદ્ધાર્યાં અને અમારા નિવાસ સ્થાને પ્રસાદ લીધો તેમ જ રાત્રીરોકાશ કર્યું. પ. પૂ. ગુરુદેવે કૃપા કરી અમને સર્વેને શિબિર કરવાનો મોકા આપ્યો એ બદલ કોટિ કોટિ દંડવત્ત પ્રશાસ. શિબિરમાં ખામીઓ તો ઘણી હતી પણ તે બધીને ઉદારતાથી શિબિરાર્થીઓએ તથા પ. પૂ. ગુરુદેવે ચલાવી લીધી તે બદલ પણ અમે સર્વે ઋણી છીએ.

કાર્યક્રમમાં સવાર-સાંજ થતી આરતીમાં પણ પાઈ પૈસો નાખવાનો રિવાજ બંધ હતો. પ. પૂ. ગુરુદેવનો સત્સંગ-સ્વાધ્યાય, પાતંજલ યોગદર્શન પર પ્રવચન, ચોવીસો કલાક ગંગારામભાઈની ખુલ્લી રહેતી “અન્નપૂર્ણા”, દરેક ને ગરમ પાણીથી સ્નાન કરવાની સગવડ, જાજરુ-બાથરૂમ વગેરે શિબિરના અંગો હતાં.

જગ્યા પણ એવી પસંદ થઈ કે જગ્યાં શોર-બકોરનું નામ નહીં. જગ્યાં શુદ્ધ પર્યાવરણ અને શુદ્ધ આહાર. સ્વધાર, ગામ તથા નેશનલ હાઇવેથી દૂર.

પ. પૂ. ગુરુદેવનો પ્રસાદ તેમની કુટીરમાં જતો અને તે પણ મોટે ભાગે ગંગારામભાઈ જ લઈ જતા. એક દિવસ ગંગારામભાઈએ તે કામ ભીજા ભાઈને સુપ્રત કર્યું. પ. પૂ. ગુરુદેવે પ્રસાદ લઈ લીધો. વધારે પ્રસાદ હોય તો ગુરુજ બીજી થાળીમાં વધારાનો પ્રસાદ

॥ સત્યધર્મ ગુરુદેવ કી જગ ॥

રત્નભરા

પહેલેથી જ કાઢી નાખતા. આ રીતે વધેલો પ્રસાદ તે ભાઈએ રસોડાની રસોઈમાં પાછો નાખ્યો. આ દશ્ય એક ભાઈએ જોયું. તેઓએ આનો સખત વિરોધ કર્યો તેમની પાસે હું ગયો અને નભ્રતાથી પ્રસાદની વાત કરી. પૂ. ગુરુદેવ કયારેય એહું છોડતા નથી તે સમજાવ્યું. પણ તેઓ સમજ્યા નહીં, ત્યારે તેમને મેં કહી દીધું કે ભાઈ અમે તો પૂ. શ્રીનું એહું જ ખાવા આવ્યા છીએ, તમારી ઈચ્છા હોય તો પ્રસાદ લો નહીં તો તમારા અને સાથે અમરાં પણ નસીબ. આવા નાના-મોટા કડવા-મીઠા પ્રસંગો પણ બનતા, પણ પૂ. શ્રીની કૃપાથી મોદું સ્વરૂપ થતું નહીં.

એક વખતે હું અને ભાનુભાઈ શિબિરથે બનાવેલાં બોર્ડ ગાડી પર મૂકીને જતા હતા. રાત્રીના બારેક વાગ્યા હશે. નાના-મોટાં ઘણા બોર્ડ હતાં. બેતરમાં જઈને જોયું તો એક બોર્ડ ન મળે. સમય બહુ ઓછો હતો એટલે નવું બોર્ડ બનાવવું શક્ય નહોતું. અમે રોડ પર જાત-તપાસ કરી પણ ન મળ્યું. બીજા દિવસે ગાડીમાં બેઠેલા તમામને સૂચના કરી કે ચારે બાજુ જોતા રહેવું. એ બોર્ડ સવારે એટલે કે સાત વાગે રોડ પરથી મળી આવ્યું. ઉત્તીને ચોકીમાં પડ્યું હતું. આવા તો અનેક અનુભવ થયા છે જેથી એમ લાગતું કે પૂ. શ્રી સાથેને સાથે છે.

પ્રચાર પત્રિકા નં. ૧૩૩

-યોગભિક્ષુ

બધી પરબોનું મૂળ સાચી સમજણ છે
પાણી પાયે પાંચ પુણ્ય, છાશ પાયે પુણ્ય સો;
અન્ન ખવરાવે અનેક પુણ્ય, જો મન
કચવાય નહીં તો.

પાણી પિવડાવવાથી પાંચ પુણ્ય, છાશ પિવડાવવાથી સો પુણ્ય અને અન્ન ખવરાવવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે પણ શરત એટલી કે એ બધું મન કચવાયા વિના જો કરી શકાય તો; અર્થાત્ કેવળ નિઃસ્વાર્થ ભાવે; વેપારીવૃત્તિ વિના જો આચરી શકાય તો.

શામાં કેટલાં પુણ્ય અને શામાં કેટલાં નહિ તેની તો આપણાને જાણકારી મળી, પણ એ જાણકારી ક્યાંથી મળી? કોઈ પાસેથી સાંભળવાથી, કે કોઈનું સત્ત્સાહિત્ય વાંચવાથી એ જાણકારી પ્રાપ્ત થઈ. તો, આવી જાણકારી આપનારનું જો સાચું મૂલ્ય આપણાને સમજાય તો તો અનંત પુણ્યો જ મળે ને!

પાણીની, છાશની, રસની વગેરે પરબો બેસાડનારાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પરંતુ આવી બધી પરબો બેસાડવાની પ્રેરણા આપેછે સાચી સમજણ. તેથી બધી જ પ્રકારની કલ્યાણકારી પરબોનું મૂળ છે સાચી સમજણ. માટે સાચી સમજણ આપતા સત્ત્સાહિત્યની, કલ્યાણસાહિત્યની પરબનું અમૂલ્ય મૂલ્ય લોકસેવાના ભેખધારીઓને સમજાવું જોઈએ. સત્ત્સાહિત્યના અર્થત્ત નિર્ભર સમજ્યુક્ત સાહિત્યના પ્રચાર-પ્રસારને વધુમાં વધુ ઉત્તેજન અને અગ્રસ્થાન આપીએ તો જ તેનું મૂલ્ય સમજાવ્યું કહેવાય.

છાશની પરબનું તો આપણને મહત્ત્વ-મૂલ્ય સમજય પણ તે પરબની પ્રેરણા આપનાર સાચી સમજણ જેમાં પીરસાયેલી છે તેવા સત્ય-સાત્ત્વિક-પવિત્ર સાહિત્યની કિંમત જો આપણાને ન સમજાય તો આપણે કેટલાં જરૂર કહેવાઈએ ! ચાહે જરૂર પણાના કારણે કે

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને તેમની જય તો જ આપણી જય ॥

આત્મવંચનાના કારણે અથવા કોઈપણ કારણે આપણે જો દરેક દરેક પરબોની પ્રેરણાની જન્મદાતી પરબ બેસાડવામાં ઉદાસીન રહીશું તો વહેલા કે મોડા બીજી બધી જ પરબો સુકાઈ જવાની. માટે સમયસર ચેતીએ. નહીં તો પછી ‘અબ પછ્યતાકર હોત ક્યા? જબ ચિદિયા ચુગ ગઈ ખેત.’

પવિત્ર-ધાર્મિક ઉત્સવોના વહીવટદારો, ઉત્સવસ્થાનમાં અન્ય પરબો બેસાડવા માટે તથા સામાન્ય સ્ટોલો ઊભા કરવા માટે ભલે ડોનેશન લે પણ સાચી સમજણ પીરસતા સાહિત્યની પરબો બેસાડવા માટે તો તેમણે સામેથી ડોનેશન આપવું પડે. જે વહીવટદારોમાં આવી મૌલિક અને શુદ્ધ સમજણ અને ત્યાગની તૈયારી હોય તે જ વહીવટદારો આવા પવિત્ર ઉત્સવોના સાચા ઉદ્દેશ્યને સફળ કરી શકે. બાકી તો ‘પીછે સે ચલી આતી હે અને ચલતી કા નામ ગાડી.’

સ્વાર્થ ભિન્ન ભિન્ન સ્વરૂપે મનુષ્ય-મનમાં પેસીને તેને ભમાવી નાખે છે અને કથા તથા ધર્મના નામે પણ વેપારીવૃત્તિને જ અગ્રસ્થાન આપવા તેને મજબૂર કરે છે. આ ઘણી મોટી આત્મવંચના છે. તેથી જ અખા ભગતે માયાથી ચેતવ્યા છે કે-

જીણી માયા છાની કરી, મીઠી થઈને મારે બરી;

વળગી પછી અળગી નવ થાય, જ્ઞાની પંડિતને માંદ્યથી ખાય.

અનેક રૂપે માયા રમે, જ્યાં જેવું ત્યાં તેવું ગમે; અખા માયાના ઘણા છે ઘાટ, જ્યાં જુઓ ત્યાં માયાનાં જ હાટ.

સુખી થવાનો સાચો પ્રયત્ન કર્યા સિવાય જ આપણે સુખી થવું છે એ પણ કેટલું મોહું વિરસ્ય છે!

ગરુચરણોમાં શું મુકીશું?

(૨૧-૭-૮૬ - મહેસાણા)

“ગૌરવ લેવા જેવું જે કાંઈ આપણામાં છે તેનો યશ ગુરુજનોને છે” એવું માનનારા ગુરુભક્તો ગુરુપૂર્ણિમા ઊજવવા થનગનતા હોય તે સ્વભાવિક છે. ખરેખર તેઓ સૌ ધન્ય છે.

ગુરુપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે સૌ પ્રેમીઓ ગુરુચરણે યથાશક્તિ કાંઈક સ્થૂળ ભેટ મુકીએ છીએ. આમ કરવું તે શાસ્ત્રની પરિધાટી છે તેથી પ્રશંશનીય છે. પરંતુ આ નિયમ સર્વસામાન્યજનો માટે છે. વિશિષ્ટ જનોએ ભેટરૂપે કાંઈક વિશેષ મૂકવું જોઈએ.

સંતોષરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત કરવામાં જે જે કાંઈ વિઘ્નરૂપ લાગતું હોય તે સર્વ કમપૂર્વક ગુરુચરણોમાં ભેટ મુકવું જોઈએ. જો નિષાપૂર્વક આ કમ અખંડ ચાલે તો ગીજ ગુરુપૂર્ણિમાએ ‘નાડીશુદ્ધિ’ થાય. છઢી ગુરુપૂર્ણિમાએ ‘ઓજ’ પ્રગટે, નવમી ગુરુપૂર્ણિમાએ ‘રહસ્ય’ પ્રાપ્ત થાય અને બારમી ગુરુપૂર્ણિમાએ સંપૂર્ણ ‘સંતોષધન’ મેળવીને સાચા ધનવાન, સાચા તનવાન અને સાચા મનવાન થઈને સિદ્ધાવસ્થાનો સ્વાનુભવ કરીને કૃતકૃત્ય થઈ જવાય.

આ સિવાય તો જન્મોજન્મ સામાન્ય ગુરુપૂર્ણિમા ઊજવતા રહીએ અને સામાન્ય આનંદ માણસતા રહીએ. અને તો, નરસી મહેતાએ કહું છે તેમાં થોડો ફરક કરીને એમ કહી શકીએ કે :

ગુરુના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે,

નિત્ય સેવા, નિત્ય કિર્તન-ઓચ્છવ, નીરખવા ગુરુ ભગવાન રે!

સંતોષધન પ્રાપ્ત કરીને આત્મંતિક સુખ પ્રાપ્ત કરી લેવું છે? કે અનેક જન્મો ધારણ કરીને સુખદુઃખ

॥ સત્યધર્મ ગુરુદેવ કી જ્ય ॥

રૂતમ્ભરા

અને હર્ષશોકના અનંત ઝાટકા સહેવા છે? જે કરવું હોય તેમાં સૌ સ્વતંત્ર છીએ.

સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય તેવું તેમારા ગુરુતમને કદી આપે છે? ગુરુજનો પાસેથી તેવું લેવાનો તમે કદી પ્રયત્ન કર્યો છે? જ્યાં સુધી તેવું આપીશું નહિ ત્યાં સુધી તેવું મળશે ક્યાંથી? સાચા ગુરુસંતોને સોનું-રૂપું કે રૂપિયા ડેલરથી ખરો આનંદ નથી થતો; તેઓ તો ‘લઘુ’ને ‘ગુરુ’ બનાવીને રાજી થાય છે. તેઓ આપણાને ‘ગુરુ’ બનાવી શકે તેવી ભેટ આપણે કદી તેમના ચરણોમાં મૂકી છે? ક્યારે મૂકીશું? શું ત્યારે કે જ્યારે “શું કહી મારી કથની ભેરુ, કાળિયા સઢિ એટર ભેણ્યું?”

ગુરુપૂર્ણિમા એટલે?

બચપણથી બુઢાપા સુધી. જીવનથી મૃત્યુ સુધી જાણ્યે-અજાણ્યે જેણે જેણે આપણને સહાય કરી છે તે સર્વેના ગુણપ્રદાનનો સ્વીકાર કરવાનો, તેમના ઋણનો સ્વીકાર કરવાનો જે દિવસ નક્કી કરવામાં આવ્યો તે જ ગુરુપૂર્ણિમાનો દિવસ.

ગુરુપૂર્ણિમા એટલે અન્યોની સહાયનો નિખાલસ ભાવે, જાહેરમાં સ્વીકાર કરવાનો સામૂહિક દિવસ; અન્યોના ગુણને ગાવા-બિરદાવવાનો દિવસ.

સદ્ગુણપ્રેરક પત્રિકા

-ડૉ. સ. સ. ભિક્ષુ

ગુરુર્બહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરः ।
ગુરુર્ સાક્ષાત્ પરબ્રહ્મઃ તસ્મै શ્રી ગુરુવે નમઃ ॥
સાત સમંદર સાહી કરું, કલમ સકલ વનરાઈ,
અનંત હાથ હરદમ લીખે, પણ ગુરુગુણ
લખ્યાન જાઈ.

ઉપરોક્ત ગુરુમહિમા આપણા શાસ્ત્રોએ ગાયો છે અને તેનું ધ્યાન મહત્ત્વ છે.

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુર્દેવ અને તેમની જ્ય તો જ આપણી જ્ય ॥

પોતાના સ્વભાવની ઉદારતા વ્યક્ત કરવાનો લ્હાવો લેવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા.

કોઈ પાસેથી તેની વસ્તુ થોડી મિનિટ માટે વાપરવા લઈએ છીએ તો પણ તેને ‘થેંક્યુ’ કહીએ છીએ. તો શું, જેઓ જિંદગીભર પોતાના વ્યક્તિગત સુખનો ભોગ આપીને આપણા કલ્યાણ માટે મથતાં રહ્યા તેમને કાંઈજ નહીં કહેવાનું? જરૂર કહેવાનું. તેમને તો કોઈપણ પ્રકારના બદલાની ઈચ્છા નથી. આ તો આપણે આપણા મનના સમાધાન માટે આપણા હદ્યનો બોજ ઓછો કરવા માટે થેંક્યુ કહેવાનું છે. પણ આ થેંક્યુ નો પ્રકાર કેવો છે? બસ! ખરા બે ફૂલ ચંદ્રાવીને, બે હાથ જોડીને મસ્તક નમાવવાનું છે. આ આધ્યાત્મિક થેંક્યુ નો પ્રકાર છે અને તેના માટેનો દિવસ છે. ગુરુપૂર્ણિમા અસ્તુ.

ઓછી સમજણના કારણે ગુરુપ્રથાનું મંડળ કરવામાં અતિશયોક્તિ થઈ જતી હોય છે અથવા ગુરુપ્રથાનું ખંડન કરવામાં અતિશયોક્તિ થઈ જતી હોય છે બંને પ્રકારની અતિશયોક્તિ કરવાવાળા જાણ્યે-અજાણ્યે પોતાને તથા સમાજને નુકસાન પહોંચાડતા હોય છે.

પરમ કૃપાળું પરમાત્મા આપણા સૌ ઉપર અહેતુકી કૃપા વરસાવે એ જ તેમને પ્રાર્થના.

ઓમ્ પરિવારની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ તેનો કોઈ ચોક્કસ અંદાજ નથી, પણ પૂ. ગુરુર્દેવ શ્રી યોગાભિક્ષુજી ઓમ્ના પ્રેમી ઉપાસક એટલે તેમની સાથે રહેતો પ્રેમીઓ-ભક્તોનો સમુદાય પણ ઓમ્ પરિવાર કહેવાયો. પૂ. શ્રી તો આખા જગતને ઓમ્ પરિવારમાં ગણાવે છે. તેઓ કોઈ મંડળ કે પાંચ-પચીસના સમુદાયને ઓમ્ પરિવાર કહેતા નથી, જડ

અને ચેતન સર્વનો ઓમું પરિવારમાં સમાવેશ થઈ જય છે તેમ તેઓશ્રી કહે છે.

ઓમું પરિવારની શરૂઆતની મ્રવૃત્તિઓ જ્ઞાનપ્રચારની હતી, તે માટે ગાયત્રી-મારુતિ યજો થતા. તે દરમિયાન પૂ. શ્રીનાં વક્તવ્યો ટેપ કરવામાં અને તેને લખવામાં આવતાં જે પત્રિકાઓ રૂપે લોકોમાં વિનામૂલ્યે વહેંચવામાં આવતાં. જેને પૂ. શ્રીએ “સત્ત-સાહિત્ય પ્રચારપત્રિકા” નામ આપ્યું. અત્યાર સુધીમાં સ. સા. પ્રચારપત્રિકાઓ એકસો છ બહાર પડી ચૂકી છે.

આ બધું કામ વ્યવસ્થિત રીતે થાય અને તેનું સંચાલન કોઈ એક સ્થળેથી નિયમિત અને વ્યવસ્થિત થાય એટલા માટે સંસ્થાની જરૂર પડી. તે ટ્રસ્ટ દ્વારા કરી શકાય, એટલે ટ્રસ્ટ રચવાની જરૂર પડી. ટ્રસ્ટનું નામ છે : “ઓમું ગુરુ પ્રેમસર્વણાધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ”

ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનદાન છે, એટલે કે સાચી સમજજ્ઞા લોકો સુધી પહોંચાડવી, જેથી વહેમો, ભ્રમજ્ઞાઓ વગેરે દૂર થાય. ટ્રસ્ટ દ્વારા મેન્ડિકલ તથા કેળવણીને પણ ઉતેજન અપાય છે. આ બધાં નિયમિતો દ્વારા લોકો ધીમેધીમે અધ્યાત્મ તરફ વળે તેની પણ

કાળજ લેવામાં આવે છે.

ઓમું પરિવાર વર્ષમાં આઠેક ઉત્સવ ઉજવે છે, જેની ફી વગેરે લેવામાં આવતું નથી. ઓમું પરિવારના પ્રસંગોમાં આરતીમાં પાઈ-પૈસો મૂકવાની પ્રથા નથી. કોઈક વખત આરતી ઉતારવા માટે ઉધામણી થાય છે ત્યારે પૈસાની બોલી બોલાતી નથી, પણ મંત્રોની બોલી બોલાય છે. એટલે કે જે વધારેમાં વધારે મંત્રો કરે તે આરતી ઉતારે.

પૂ. શ્રીનો કોઈ આશ્રમ નથી. તે બાબતમાં તેઓશ્રી કહે છે કે, ×મારા પ્રેમીઓ અને તેમનાં ધરો જ મારો-મારા આશ્રમ-આશ્રમો છે. સૌએ પોતાના ધરમાં રહીને જ આશ્રમી જીવન-અનુશાસનમય જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે.”

અત્યાર સુધીમાં ઓમું પરિવારનાં નાનાં-મોટાં ચોવીસ પ્રકાશનો બહાર પડી ચૂક્યાં છે. મુખ્ય હેતુ જ્ઞાનદાનનો હોવાથી પુસ્તકની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવે છે. સર્વજીવ કલ્યાણ હેતુ અત્યાર સુધીમાં સમૂહમાં ઘણા ઘણા જપયજ્ઞાનું આયોજન થઈ ચૂક્યું છે અને જપયજ્ઞો થતા જ રહે છે.

પુરુષોત્તમ માસ એટલે ઉત્તમપુરુષ થવાનો માસ

-યોગભિક્ષુ

મંદિરે જાય ત્યારે ખોરી સોપારી, પોતે સારી ખાય,

અભાગજી પુરુષોત્તમ મહિનો ન્હાય !

શું પુરુષોત્તમમાસ આવી રીતે નહાવાનો ?
પોતે સારું સારું ખાવુંપીવું, પહેરવું-ઓઢવું અને મંદિરના ભગવાનને અને કથા વાંચનાર મહારાજને ખોરુંખોરું ધરાવવાનું અને આપવાનું ? અન્યોને છેતરવામાં પોતે જ છેતરાઈએ છીએ તેવી ઉત્તમ સમજજ્ઞ ઉત્તમ

મહિનામાંય પ્રામ નહીં કરવાની ?

“પુરુષોત્તમમાસની કથા” પુસ્તકમાં તો જીતમાતની ચિત્રવિચિત્ર વાતો કહેવાયેલી છે. પણ તે બધાયનો સાર છે ઉત્તમકાર્યો કરીને ઉત્તમ બનવાનો. નિર્ધારિત સમયે નિર્ધારિત પર્વો આવે છે. પુરુષોત્તમમાસ દર ત્રીજા વર્ષે આવે છે. આ માસને અધિક માસ પણ કહે છે. અધિક માસનો અર્થ જ એ છે કે તે માસમાં

॥ સત્યધર્મ ગુરુદેવ કી જય ॥

રત્નભરા

કાંઈક અધિક - કાંઈક વિશિષ્ટ કાર્ય કરવું જોઈએ.

કોઈ પણ ભોગે સુખી થવા માટેની જે આંધળી દોટ મનુષ્ય મૂકી છે તેમાં “નુકાવ અને આત્મનિરીક્ષણ કરો” ની બ્રેક પુરુષોત્તમમાસ લગાવે છે. દર ત્રણ વર્ષે આ માસ એ વિચારવાનો મોકો આપે છે કે ઉત્તમકાર્યો કરીને તમે કેટલા ઉત્તમ બન્યા? માને એમ લાગે છે કે દીકરો મોટો થઈ રહ્યો છે. પણ દીકરો તો મૃત્યુ તરફ ધ્સી રહ્યો છે” તે કહેવત જેવું આપણું જીવન છે. આ જન્મે તો થોડું સુખ ગ્રામ થયું છે પણ આવતા જન્મે પણ સુખશાંતિ ગ્રામ થાય એવું કાંઈ કર્યું? કે પછી ધૂમાડને જ બાચકા ભરતા રહ્યા અને સમય પૂરો થઈ જવા આવ્યો?

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞની ઘણી મોટી મહત્ત્મા છે. યજ્ઞ એટલે અન્યો માટે કાંઈક ત્યાગવું. વધુમાં વધુ પ્રિય વસ્તુને ત્યાગવી તે ઘણો મોટો યજ્ઞ ગણાય છે. “ત્યાગને જ ભોગ સમજ” એ સૂત્ર ભારતીય સંસ્કૃતિનો ગ્રાણ છે.

ગીતામાં કહ્યું છે કે યજ્ઞોમાં જપયજ્ઞ હું દ્ધું. જપયજ્ઞને આટલો શ્રેષ્ઠ શા માટે ગણ્યો હશે? કારણ કે જપયજ્ઞ સાવ સહેલો, સસ્તો અને બહુમૂલ્ય છે. અન્યો માટે શુભ ભાવના રાખવી કે વહાવવી તેને ઋષિઓ યજ્ઞ સમાન લેખે છે. મનુષ્ય વિચારે છે કે, હું તો સાવ ગરીબ દ્ધું, કઈ રીતે યજ્ઞ કરી શકું? ગરીબ અને તવંગર સહુ કોઈ જપયજ્ઞ કરી શકે છે, જીવમાત્ર તરફ શુભ ભાવનાઓ વહાવી શકે છે.

શુભ ભાવનાઓનું, શબ્દોના માધ્યમથી રટણ કરવું તે જપયજ્ઞ કહેવાય છે. ઉપલક દસ્તિએ, શુભ ભાવના રાખવાની વાત બહુ મહત્વની નથી લાગતી, પણ સૂક્ષ્મ રીતે જોતાં તેની મહત્ત્વ જરૂર સમજાય છે. મનુષ્ય વધુ પોતાના વિચારોના - પોતાની ભાવનાઓના સંગમાં રહે છે તેવો તે બને છે. મનુષ્ય વધુમાં વધુ પોતાના વિચારોના - પોતાની ભાવનાઓના તે બનશે. પોતાની સારી-માઠી ભાવનાઓ ગ્રમાણે પોતે

તો બને જ છે, પરંતુ અન્યો ઉપર પણ તેની ઘણી જોરદાર અસર થતી હોય છે. કોઈની આપણે નિંદા-પ્રશંસા કરીએ તેની સારી-માઠી અસર તેના ઉપર જરૂર થાય છે. શબ્દશક્તિ અમોઘ છે.

જેમની ભાવના ખરેખર જ યજ્ઞ કરવાની છે તેમના માટે અનેક મોકા છે. અને જેમને બહાનાં બતાવીને છટકી જવું છે તેમના માટે આખિર ધૂલ કી ધૂલ જ છે.

વર્તમાનકાળમાં પાણીની કેટલી હાડમારી છે? પાણીની કાળજી માટે અનેક વખત સાવધાન કરે છે, પણ જાણે કોને કહે છે? આપણા નળો તો બેફામ ચાલુ. બાલટી છલકાઈને પાણી બહાર ધરસમસી રહ્યું છે, આપણે બાજુમાં જ બેઠા છીએ, પણ નળને બંધ કરવા જેટલી પણ આગસ છોડતા નથી! જ્યાં સુધી આપણા ગોરામાં પાણી છે ત્યાં સુધી પાણીની હાડમારીની વાત આપણને સાચી જ ના લાગે તે કેટલું જરૂરપણું કહેવાય! આ જરૂરપણું ના છટે, તો પછી ભલેને ગમે તેટલા પુરુષોત્તમમહિના નહાઈએ એથી શું? ઉત્તમ મહિનામાં આપણે ક્યું ઉત્તમપણું મેળવ્યું? અરે! આપણે ત્યાં નીકળતો એઠવાડ કે શક્ભાજી કે ફળાદિનાં છોતરાં પણ જો ભેગાં કરીને ઢોરને મોઢે જાય એવી વ્યવસ્થા કરીએ તો ય સાવ મફતમાં જ કેટલાય જીવોને મરતા બચાવી શકીએ.

આવી ઉત્તમોત્તમવાતોને પુરુષોત્તમમાસમાં આપણે કદી યાદ કરીએ છીએ? પુરુષોત્તમમાસની સાચી કથા તો આવી વાતો છે. કેટલા બધા પુરુષોત્તમમાસ પસાર થઈ ગયા અને આપણાં વર્ષો પણ પસાર થઈ ગયાં તો ય ઉત્તમપણું ગ્રામ ના થયું. હોશિયાર વ્યક્તિ દરેક માસને ઉત્તમ માસ બનાવી દે છે અને મારા જેવો જરૂરભરત પુરુષ અનેક ઉત્તમ માસ નાહીને પણ જરૂરભરત અને મળભરત જ રહે છે - અનઉત્તમ પુરુષ જ રહે છે!

કહની મિસરી ખાંડ હૈ, કરની તત્ત્વ લોહ;
કહની કહે અને રહની રહે, ઐસા વિરલા કોક.

॥ સત્ય અને ધર્મ એ જ આપણા ગુરુદેવ અને તેમની જય તો જ આપણી જય ॥

ओंशर का बोधक (नाम) प्रणव/ओम् है।



(साधिष्ठाद के मुद्रों का भावानुवाद)

- (२४) क्लेश, कर्म, कर्मफल और वासना जिसमें नहीं है ऐसा पुरुषविशेष/चेतनविशेष ओंशर है।
- (२५) ओंशर संपूर्ण सर्वज्ञ है।
- (२६) ओंशर पूर्वकाल के गुरुओं के भी गुरु है और कल की मर्यादा से (जन्म-मृत्यु से) पर है।
- (२७) ओंशर का नाम प्रणव/ओम् है।
- (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करना।
- (२९) चिन्तन सहित जप करने से अन्तरायों का अभाव और आत्मसाक्षात्कार होता है।

● ट्रस्टना उद्देशो

(१) सर्वव्यापक परम सूक्ष्म योग्यता के जेनुं नाम प्रणव (ओम्-ॐ्) छे तेनी प्रतीति बहुजनसमाजने करावानो प्रयत्न करवो। (२) 'योग'नो प्रयार, प्रसार अने संशोधन करवा प्रयत्न करवो। (३) समाजनुं नैतिक धोरण उंचुं लाववा माटे साहित्य द्वारा आध्यात्मिक ज्ञाननो प्रयार अने प्रसार करवानो प्रयत्न करवो। (४) आ उपरांत 'बहुजनहिताय-बहुजनसुखाय'ने लगातां कार्यों, जेवां के, केषवणी, तबीबी सारवार वगोरे करवा माटे प्रयत्न करवो।

- પ.પૂ. ગુરુદેવશ્રી યોગભિક્ષુજી મહારાજશ્રી સાથેનાં પ્રેરક પ્રસંગો - સંસ્મરણો સંક્ષિપ્તમાં આવકાર્ય છે.
 - “ઓમ् પરિવાર”ની કલ્યાણકારી પ્રવૃત્તિઓ વિશેની માહિતી પણ સંક્ષિપ્તમાં આવકાર્ય છે.
- નોંધ : જગ્યા-મર્યાદાને કારણે અન્ય કૃતિ-સામગ્રી સ્વીકારી શકાતી નથી.
- રૂતમ્ભરા સંપાદન સમિતિ

લવાજમદર :

ત્રિવાર્ષિક સભ્ય(મારતમાં) ...	₹ ૧૦૦-૦૦
આજીવન સભ્ય(મારતમાં) ...	₹ ૫૦૦-૦૦
ત્રિવાર્ષિક સભ્ય(પરદેશમાં) ...	\$ ૫૦-૦૦
આજીવન સભ્ય(પરદેશમાં) ...	\$ ૧૫૦-૦૦

લવાજમ મોકલવાનું કે રૂતમ્ભરાને લગતો

પત્રવ્યવહાર કરવાનું સ્થળ :

તંત્રીશ્રી,

‘રૂતમ્ભરા’ સામયિક,
ઓમ્ભગુરુ પ્રેમસમર્પણધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ
સી-૩૮, રવિકુંજ એપાર્ટમેન્ટ,
પ્રભાત ચોક, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦૦૬૧.

ગૃહનંબિની નંબર : ૮૮૨૫૪૪૩૬૪૨

કૂચના :-

(૧) લવાજમ ચેક, ડ્રાઇટ અથવા મનીઓર્ડર દ્વારા “ઓમ્ભગુરુ પ્રેમસમર્પણધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ” ના નામે મોકલવું. સાથે આપનું પૂરુ નામ, સરનામું શુદ્ધ અક્ષરોમાં લખી મોકલવાં.

(૨) જે સભ્યના રહેઠાણનું રૂતમ્ભરા અંક મોકલવાનું સ્થળ બદલાયું હોય તેમણે તેમના નવા રહેઠાણનું પૂરુ સરનામું L.M. નંબર સાથે લખી મોકલવું, જેથી વ્યવસ્થાપકો દ્વારા અંક મોકલવામાં સરળતા રહે.

E-mail : aumparivar@yahoo.com
Mob. : 9313675728

Registrar of News Papers of India
under Regd. No. 48770/90
L-5/131/QTY./34/90-91
Published on Every 3 Months

આધુનિક સંસ્કરણ તથા આધ્યાત્મિક પડા
પ.પૂ. ગુરુદેવશ્રી યોગભિક્ષુજી

PRINTED & PUBLISHED BY :-

AUMGURU PREMSAMARAPANDHYANBHIKSHU
PARIVAR TRUST

(Reg. No. E/4416 Date 11-5-81)

From : C-39, Ravikunj Apartment,
Ghatlodia, Ahmedabad-61.

Printed at : Shardul Printing Press

Hon. Editor : Minish Patel

I.T.Exe. DIT (E)/80G(5) / 252 / 2008-09

